



**SURAT MUNICIPAL CORPORATION  
HYDRAULIC DEPARTMENT  
QUOTATION / CONSENT FORM**

<b>QUOTATION NO DMC/HYD/04/2025-2026</b>		<b>DATE : 11/08/2025</b>
<b>Name of Work :</b> સુરત મહાનગરપાલિકાના સાઉથ વેસ્ટ (અઠવા) ઝોનમાં આવેલ વેસુ-રૂંઢ-મગદલ્લા -ભરથાણા -આબવા વગેરે વિસ્તારમાં નવા વાલ્વ ચેમ્બર બનાવવા તેમજ જુના ચેમ્બરને રીપેરીંગ અને મરામતની કામગીરી બાબત.		
<b>ESTIMATED AMOUNT :Rs.24,81,860.25/-</b>		<b>EMD AMOUNT : Rs.25,000/-</b>
<b>Validity Period : 120 Days</b>		<b>Agency category : "E1" &amp; Experienced</b>
<b>Required Documents</b>		
1	Solvency Certificate (20% Of Estimated Amount not older than one year)	Yes
2	Registration Certificate	Yes
3	GST Registration Certificate	Yes
4	Last One year Income Tax Return Certificate	Yes
5	Similar Work Compilation certificate / Form 3A	Yes
6	Pan Card Copy	Yes
<b>QUOTATION/CONSENT AVAILABILITY</b>		
<b>ISSUING AUTHORITY</b>	Hydraulic Engineer, Hydraulic Department, Surat	
<b>ISSUING OFFICE</b>	Administrative office, Hydraulic Department, 1st Floor, Althan Swimming Pool,Opp.DRB College,Althan, Surat	
<b>INVITING AUTHORITY</b>	Hydraulic Engineer, Hydraulic Department, Surat	
<b>Submission Date</b>	<b>Last date: 20/08/2025</b>	
	<b>SUBMITTED TO,</b>	
Time: 18.00 P.M.	HYDRAULIC ENGINEER HYDRAULIC DEPARTMENT, 1ST FLOOR,,ALTHAN SWIMMING POOL,OPP.DRB COLLEGE,ALTHAN,SURAT. 395007	
<b><u>GST CLAUSE FOR CONSTRUCTION/ ERECTION/ COMMISSIONING/ INSTALLATION/ REPAIRS/ MAINTENANCE/ RENOVATION/ FABRICATION OF STRUCTURE INCLUDING BUILDING (MEANS ALL WORKS CONTRACT/ TURN KEY PROJECT/ SUPPLY OF MATERIAL/ GOODS)</u></b> GST (Goods and service tax has come in existence from 1st July, 2017. Contractor / Successful Bidder is bound to pay any amount of GST prescribed by the govt. of India as per the terms of contract agreed upon during the course of execution of this contract. During the course of execution of contract, if there is any change in rate if GST (Goods and Service Tax) by the Government, the same shall be reimbursed/recovered separately by SMC. subject to the submission of original receipt/proof for the amounts actually remitted by the contractor/ successful Tenderer to the competent Authority along with a certificate from Chartered Accountant of contractor/ successful Tenderer certifying that the amount of GST paid to the government and the same shall be intimated/submitted/claimed within 30 (Thirty) days from the date of payment. Remittance of GST within stipulated period shall be the sole responsibility of the successful contractor/Tenderer, failing which SMC may recover the amount due, from any other payable dues with SMC and decision of Municipal Commissioner shall be final and binding on the contractor/ successful Tenderer in this regard. Further, the non-payment of GST to the government may lead to the termination of contract and forfeiture of security Deposit/Performance Guarantee Amount. If imposition of any other new taxes/Duties/levies/Cess or any other incidentals etc. or any increase in the existing taxes/Duties/Levies/Cess or any other incidentals etc. (Excluding GST) are imposed during the course of the contract, the same shall be borne by the successful contractor/Tenderer only, in no case SMC shall be liable for the same.		
<b>SIGNATURE OF ISSUING AUTHORITY</b>		
HYDRAULIC ENGINEER HYDRAULIC DEPARTMENT SURAT MUNICIPAL CORPORATION		